



COVID-19 વૈશ્વિક મહામારી દરમિયાન બ્રેમ્પટનમાં સિવિક હોલિડે 2021

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 28, 2021) – આ વર્ષે, સિવિક હોલિડે (જાહેર રજા) સોમવાર, ઓગસ્ટ 2 નાં રોજ આવશે. અહીં તે દિવસે સીટી ઓફ બ્રેમ્પટનની સર્વિસીસ વિશે તમારે જાણવી જરૂરી બાબતો જાણાવી છે.

અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓ સમુદાયની સહાયતા માટે રાબેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) નંબર પર ફોન કૉલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ www.311brampton.ca જોઈ શકે છે, ઇમેઈલ સરનામું 311@brampton.ca ને ઇમેઈલ મોકલી શકે છે. અમે સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલને સંબંધિત કોઈપણ બાબતો માટે 24/7 ઉપલબ્ધ રહીએ છીએ. COVID-19 સંબંધિત પૂછપરછો માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/COVID19.

આતશબાજી સુરક્ષા

સીટી ઓફ બ્રેમ્પટન સિવિક હોલિડે પર કોઈ આતશબાજી પ્રદર્શન કરશે નહિ અને અંગત રીતે આતશબાજી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.

સિવિક હોલિડે વર્ષના એ ચાર દિવસોમાંનો એક નથી જ્યારે સીટી ઓફ બ્રેમ્પટનમાં અંગત આતશબાજી કરવાની છૂટ આપવામાં આવે છે. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/bylaws.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સિવિક હોલિડે પર રવિવાર/રજાના દિવસના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે પણ કેટલાક રૂટ્સ રદ કરવામાં આવશે. નીચે જાણાવેલા રૂટ્સ સર્વિસમાં રહેશે:

- 501 જુમ ક્વીન
- 502 જુમ મેઈન
- 505 જુમ બોવાર્ડ
- 511 જુમ સ્ટીલ્સ
- 1 ક્વીન
- 2 મેઈન
- 3 મેકલાકિલન
- 4 ચિંગકુસી
- 5 બોવાર્ડ
- 7 કેનેડી
- 8 સેન્ટર
- 11 સ્ટીલ્સ
- 14 ટોરબ્રામ
- 15 બ્રેમલી



BRAMPTON

Service and Information Update

- 18 ડિક્સી
- 23 સેન્ડલવૂડ
- 29 વિલિયમ્સ
- 30 એરપોર્ટ રોડ
- 35 ક્લાર્કવે
- 50 ગોર રોડ
- 52 મેકમર્કી
- 53 રે લોસન
- 56 કિંગનોલ
- 57 ચાર્લેઈસ
- 115 પીયરસન એરપોર્ટ એક્સપ્રેસ

ટર્મિનલ્સ પરના કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ સિવિક હોલિડે પર બંધ રહેશે. ઉતારુઓને સહાયરૂપ થવા સંપર્ક કેન્દ્ર સવારે 7 થી સાંજે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. વધુ માહિતી માટે, સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ

જુઓ, www.bramptontransit.com.

વધારે સારી સફાઈ અને સેનિટાઈઝિંગ સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય દર 48 કલાકે તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

સીટી ઉતારુઓને માર્સ્ક પહેર્યો હોય તો પણ ટર્મિનલ્સ અને બસ સ્ટોપ્સ પર વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાનું ચાલુ રાખવાની વિનંતી કરે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ, જેમ કે હેન્ડ સેનિટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું પણ યાદ અપાવવામાં આવે છે. જો બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો, સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર ટેસ્ટ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

નિયમિત અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો.

અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

બ્રેમ્પટન પાર્ક્સ

સિવિક હોલિડે માટે બ્રેમ્પટનમાં લીશ-ફી ડોગ પાર્ક્સ સહિત, બધી મનોરંજનલક્ષી ટ્રેઈલ્સ (પગદંડીઓ), પ્લેગ્રાઉન્ડ્સ, અને પાર્ક્સ ખુલ્લા રહે છે. દરેક વ્યક્તિના આરોગ્ય અને સુખાકારી માટે શારીરિક પ્રવૃત્તિ મહત્વની હોય છે. આપણાં પાર્ક્સ અને ટ્રેઈલ્સ શોધવા વેબસાઈટ

જુઓ, www.brampton.ca/parks.

બ્રેમ્પટન રિક્રિએશન

સીટી ઓફ બ્રેમ્પટનના પસંદ કરેલા રિક્રિએશન સેન્ટર્સ સિવિક હોલિડે દરમિયાન સીમિત કાર્યક્રમો અને સેવાઓ માટે ખુલ્લા રહે છે. મુલાકાતો લેવા [રિઝર્વેશન સિસ્ટમ](http://www.brampton.ca/recreation) અમલમાં છે, જેમાં ફિટનેસ, સ્વીમિંગ, સ્કેટિંગ, અને સામાન્ય રસપ્રદ કાર્યક્રમો સામેલ છે.



BRAMPTON

Service and Information Update

તમારા કુટુંબીજનો સાથે પાર્ક ક્લાસીસ, પ્રોફેસર્સ લૅક બીચ અને બોટલાઉસ, અને આઉટડોર સ્પ્લેશ પેડ્સમાં મફત ફિટનેસ સહિતની સુરક્ષિત રીતે આનંદ માણવા જેવી આઉટડોર સવલતો પર માહિતી માટે વેબસાઇટ જુઓ, www.brampton.ca/summerfun.

વર્ચ્યુઅલ કાર્યક્રમો અને સેવાઓ પર માહિતી માટે વેબસાઇટ જુઓ, www.brampton.ca/recathome.

બ્રેમ્પટન લાઇબ્રેરી

બ્રેમ્પટન લાઇબ્રેરીની તમામ શાખાઓ સિવિક હોલિડે નિમિત્તે બંધ રહેશે.

[બ્રેમ્પટન લાઇબ્રેરીની વેબસાઇટ](#) કોઈપણ સમયે જોઈને [ઓનલાઇન બોરોઈંગ](#) અને [ઈ-બુક્સ](#), [ઈ-ઓડિયોબુક્સ](#), [ટીવી](#) અને [મૂવી સ્ટ્રીમિંગ](#), [ઓનલાઇન શિક્ષણ](#), [આર્ટ્સ](#) અને [ક્રાફ્ટ્સ શિક્ષણ](#), અને ઘણી સવલતો સુધી, તમારા લાઇબ્રેરી કાર્ડથી મફતમાં પહોંચ મેળવો.

[બ્રેમ્પટન લાઇબ્રેરી કાર્ડ મેળવવા](#), [કૃપા કરી અહીં ક્લિક કરો](#). બંધી શાખાઓમાં 24-કલાકની બાહ્ય ડ્રોપ બોક્સીસ મારફતે તમે ઊછીનું લીધેલું સાહિત્ય પરત કરવાની લચીલી સેવાઓ મેળવો. નોંધણી કરાવો અને અમારા વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં [કેલેન્ડર ઓફ ઇવેન્ટ્સ](#) પર ભાગ લેવા અને અઠવાડિક [વર્ચ્યુઅલ સ્ટોરીટાઈમ્સ](#) સહિત વીડિયોનો આનંદ બ્રેમ્પટન લાઇબ્રેરીના YouTube પેજ પર માણવાનું આયોજન કરો.

ચાલો આપણે સંપર્કમાં રહીએ! [અમારી ઇમેઇલ અપડેટ્સ](#) અને [ન્યૂઝલેટર્સ સબસ્ક્રાઇબ કરો](#) અને અમને [Facebook](#), [Twitter](#), [Instagram](#), [LinkedIn](#) અને [YouTube](#) પર અનુસરો.

બ્રેમ્પટન લાઇબ્રેરીને આ જણાવતા ખુશી થાય છે કે તેઓની ફોર કોર્નર્સ, સીરિલ ક્લાર્ક, ચિંગકુસી, અને સિંગંગડોલ શાખાઓને સીમિત સેવાઓ માટે ફરીથી ખુલ્લી મૂકવામાં આવી છે. ગોર મીડોસ, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ, સાઉથ ફ્લૅચર્સ અને સાઉથ વેસ્ટ શાખા પુસ્તકાલયોમાં કર્બસાઇડ પિકઅપ ચાલુ રહે છે. વિગતો માટે, [કૃપા કરી અમારી વેબસાઇટ જુઓ](#).

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર સિવિક હોલિડે નિમિત્તે બંધ રહેશે.

એનિમલ કંટ્રોલ સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રોડ પર કાર્યરત રહે છે, અને માત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:

- માંદા/ઇજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી
- દોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવું
- મરેલું પ્રાણી લઈ જવું

આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઇમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

સિવિક હોલિડે માટે પીલ પબ્લિક હેલ્થના રિમાઈન્ડર્સ



રસીકરણ કામગીરી ચાલુ છે અને કેસોની સંખ્યા ઓછી થવાનું ચાલુ છે ત્યારે, COVID-19 સામે જાહેર આરોગ્ય ઉપાયો આપણાં શ્રેષ્ઠ બચાવમાં રહે છે તે યાદ રાખવું મહત્વનું છે. લાંબી અઠવાડિક રજાઓ દરમિયાન [રિઓપન કરવાના રોડમેપ](#)નું પગલું ત્રણમાં જણાવેલી પ્રોવિન્સની માર્ગરેખાઓ અનુસરીને એકબીજાની સંભાળ લેશો. હંમેશની જેમ, કૃપા કરી નીચેની બાબતો યાદ રાખશો:

- ઘરે રહો અથવા ટેસ્ટ કરાવો જો તમે બીમારી અનુભવો
- અન્ય વ્યક્તિથી 2 મીટર દૂર રહો
- તમારા હાથ ધોતા રહો
- યુસ્ત બંધબેસતો માસ્ક પહેરો
- રસીકરણ કરાવો

-30-

સીટી ઓફ બ્રમ્પટન મીડિયા સંપર્ક

પ્રભજોત કૈથ (Prabhjot Kainth)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca

રીજીયન ઓફ પીલ મીડિયા સંપર્ક

અશલી હોક્કિન્સ (Ashleigh Hawkins)

કમ્યુનિકેશન્સ સ્પેશિયલિસ્ટ – જાહેર આરોગ્ય

રીજીયન ઓફ પીલ

416.818.4421 | ashleigh.hawkins@peelregion.ca